

KP GROUP ACHIEVES HISTORIC MILESTONE

WITH SIMULTANEOUS INSTALLATION OF SEVEN WINDMILLS IN SOUTH GUJARAT

Surat: KPI Green Energy Limited, a leading company in India's renewable sector and listed on the NSE and BSE, has achieved a significant milestone by successfully installing and commissioning wind turbines in South Gujarat under the Hybrid Policy. This remarkable accomplishment is attributed to the visionary leadership of Mr. Faruk G. Patel, the Chairman and Managing Director of the company.

The KP Group, to which KPI Green Energy Limited belongs, installed a total of seven wind turbines, along with a solar portion, in various villages in Kora Village, Bharuch district. Mr. Patel expressed his appreciation for the renewable energy policy implemented by the Government of Gujarat, which facilitated the smooth execution of the project. He also extended his gratitude to Suzlon and Senvion for their prompt provision of turbines. Additionally,



he gave special thanks to Mr. Bakul Limbasia, the Promoter of Nouveau Jewellery LLP, India's leading lab-grown diamond company, for being the first to trust and invest in his vision.

Traditionally, Bhavnagar, Porbandar, and Kutch regions were considered the most suitable locations for wind turbine projects. However, KP Group's strategic venture has opened new possibilities for wind

energy in the southern part of Gujarat. Mr. Patel emphasized that this achievement is a source of pride for all involved, as it paves the way for wind energy development in the South Gujarat region. Furthermore, this initiative will significantly contribute to the ambitious target of 500 GW in renewable energy set by Prime Minister Shri Narendrabhai Modi.

The project involved the installation of two turbines for Nouveau Jewellery LLP, Green Lab Diamonds, and Mono Steel under the CPP model. Additionally, one turbine was installed by KPI Green Energy Ltd. under the IPP model. Looking ahead, the KP Group plans to undertake many more projects in the South Gujarat region, which will play a crucial role in achieving Mr. Patel's ambitious target of commissioning 2 gigawatts of energy by 2025.

KP Group Creates History South Gujarat Witnesses Its First Windmill Installation



PTI | Updated: May 12, 2023 17:01 IST

Surat (Gujarat) [India], May 12: KPI Green Energy Limited (NSE – BSE listed), the flagship company of the KP Group, a pioneering force in India's renewable sector, has made history with the installation and commissioning of wind turbines under the Hybrid Policy in South Gujarat.

This accomplishment is backed by the scientific approach of visionary Mr Faruk G. Patel, Chairman and Managing Director of the company. The group successfully installed seven wind turbines and their solar portion at various villages in Kora village, Bharuch district.

Mr Faruk G. Patel acknowledged the business-friendly renewable energy policy of the Government of Gujarat, which facilitated the project's smooth execution and also expressed his gratitude to the stakeholders like Suzlon and Senvion for their prompt provision of turbines. He expressed special thanks to Mr Bakul Limbasia, Promoter-Nouveau Jewellery LLP (India's leader in lab-grown diamonds), for first trusting and investing in his vision.

It is worth noting that until now, the most feasible locations for wind turbines in terms of wind projects were believed to be Bhavnagar, Porbandar and Kutch regions. However, KP Group's astute venture has opened new horizons in the southern part of Gujarat for wind energy.

Mr Patel emphasized that this achievement is a matter of pride for all involved, as it opens new doors for wind energy in the South Gujarat region. This initiative will majorly contribute towards the target of 500 GW under renewable energy as envisaged by our honourable Prime Minister Shri

THEWEEK



LAB DIAMONDS, AND MONO STEEL UNDER THE CFF MODEL AND ONE TURBINE FOR KPI Green Energy Ltd. under the IPP model. KP Group looks forward to installing many more projects in the South Gujarat region, which will be a key driver in achieving Mr Patel's ambitious target of 2 Gigawatt of commissioned energy by 2025.

<https://youtu.be/WVxL0itBSUU>

(Disclaimer: The above press release comes to you under an arrangement with PNN and PTI takes no editorial responsibility for the same.). PTI PWR PWR

(This story has not been edited by THE WEEK and is auto-generated from PTI)



[Terms & Conditions](#) [Privacy & Statement](#)

Copyright © 2023 All rights reserved

સુરતના ઉદ્યોગપતિએ ભરૂચમાં ૭ પવનચક્કી સ્થાપી વીજ ઉત્પાદન શરૂ કર્યું

સુરત, તા.૧૨

પવનની ગતિનો ઉપયોગ કરીને ઉર્જા ઉત્પાદનના ક્ષેત્રમાં સુરતના ઉદ્યોગપતિઓ ભરૂચી હરણકાળને કારણે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં હવે પવનચક્કી સ્થાપવાના ખિલકુલ નવા ઉદ્યોગના મંદાણ થયા છે. અન્યાર સુધી એવું માહેવું હતું કે પવનચક્કી સ્થાપીને વીજ ઉત્પાદનનો પ્રોજેક્ટ ગુજરાતમાં કક્ત કરછ અને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તાર સિવાય ગુજરાતમાં ખીજે ક્યાંય નહીં વાયેબલ થાય અને દક્ષિણ ગુજરાતમાં તો શક્ય જ નથી. આ વાતોને ચેરમાન્યતામાં તર્કદિલ કરતા સુરતના કેપી સુપના ઉદ્યોગપતિ કારુક પટેલે ભરૂચના કોરા ગામે ૭ વિન્ડ ટર્બાઈનની સ્થાપના કરીને વીજ ઉત્પાદન શરૂ કરી દેતા ખુદ ગુજરાત સરકારના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા છે.

સુરતમાં હેડક્વાર્ટર ધરાવતું કેપી સુપ સોલાર એનર્જી ક્ષેત્રમાં કાર્યરત છે. કેપી સુપના નેજા હેઠળ ચાલતી

કેપીઆઈ ગ્રીન એનર્જી સિમિટેડનાં કાળે દક્ષિણ ગુજરાતની પરતી પર સૌપ્રથમવાર હાઈલિફ્ટ પોલીએ અંતર્ગત વિન્ડ ટર્બાઈન ઈન્સ્ટોલ કરીને તેને કમિશનિંગ કરવાનું શ્રેય જાય છે.

કંપનીનાં ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર કારુક જા. પટેલે ભરૂચમાં વીન્ડ એનર્જીનો પ્રોજેક્ટ આરંભ વખાણી અને કંપનીએ હાઈલિફ્ટ પ્રોજેક્ટ અંતર્ગત ભરૂચ જિલ્લાના કોરા ગામ ખાતે કુલ ૭ વિન્ડ ટર્બાઈન નાંખી છે, જ્યારે સારોજ અને સામોજમાં સોલાર પ્લાન્ટ ઈન્સ્ટોલ કરવામાં આવ્યાં છે.

આ સાથે વિન્ડ ટર્બાઈનો નોંધીયો જવેલરી એલએમપી, ગ્રીન લેબ પ્રાઇવેટ, મોનો સ્ટીલ માટે સીપીપી હેઠળ અને એક ટર્બાઈન કેપીઆઈ ગ્રીન એનર્જીએ પોતે આઈપીપી હેઠળ ઈન્સ્ટોલ કરી છે. સામાન્ય રીતે દક્ષિણ ગુજરાતમાં પવનચક્કીનો પ્રોજેક્ટ સફળ થતો નથી એમ કહેવાય છે.



■ કેપીઆઈ ગ્રીન એનર્જી લિમિટેડ(એનએસઈ-બીએસઈ લિસ્ટેડ) દ્વારા દક્ષિણ ગુજરાતમાં સૌપ્રથમવાર હાઈવોલ્ટેજ પોલિસી અંતર્ગત વિન્ડ ટર્બાઈન ઇન્સ્ટોલ કરીને તેને કમિશનિંગ કરવાની શરૂઆત કરી છે. કંપનીના સીએમડી ફારુક જી. પટેલે કહ્યું કે, ગુજરાત સરકારની બિઝનેસ ફ્રેન્ડલી રિવ્યુએબલ એનર્જી પોલિસીને કારણે પ્રોજેક્ટ સરળતાથી પૂર્ણ કરી શકાયો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 500 ગીગા વોટ્સના રિવ્યુએબલ એનર્જીના લક્ષ્યમાં અમે પણ યોગદાન આપી રહ્યાં છે તે અમારા માટે ગર્વની વાત છે. આ સાત વિન્ડ ટર્બાઈનો નોવીયો જ્વેલરી એલએલપી, ગ્રીન લેબ ડાયમંડ, મોનો સ્ટીલ માટે સીપીપી હેઠળ અને એક ટર્બાઈન કેપીઆઈ ગ્રીન એનર્જી લિ.એ પોટે આઈપીપી હેઠળ ઇન્સ્ટોલ કર્યા છે. કંપનીએ હાઈવોલ્ટેજ પ્રોજેક્ટ અંતર્ગત ભરૂચ જિલ્લાના કોરા ગામ ખાતે કુલ 7 વિન્ડ ટર્બાઈન ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે, જ્યારે સારોજ અને સામોજમાં સોલાર પ્લાન્ટ નંખાયો છે. અત્યારસુધી પવનચક્કી માટે શ્રેષ્ઠ હવા ગુજરાતના ભાવનગર, પોરબંદર, કચ્છ સહિતના વિભાગો મહત્વના મનાતા હતા પરંતુ કેપી ગ્રુપના સાહસથી રિવ્યુએબલ એનર્જીના

ધબકાર

તા. 13/5/23

કેપી ગ્રુપે દ. ગુજરાતમાં પહેલીવાર ભરૂચ જિલ્લાના કોરા ગામે પવનચક્કી નાખી!

ધબકાર પ્રતિનિધિ, વાગરા, તા. ૧૨

રિન્યુએબલ સેક્ટરમાં કામ કરતા ઈન્ડિયાના અગ્રેસર અને સુરત સ્થિત કેપી ગ્રુપ દ્વારા ઈતિહાસ રચવામાં આવ્યો છે. કેપી ગ્રુપના નેજા હેઠળ ચાલતી કેપીઆઈ ગ્રીન એનર્જી લિમિટેડ (એનએસઈ-બીએસઈ લિસ્ટેડ)ના ફાળે દક્ષિણ ગુજરાતની ધરતી પર સૌ પ્રથમવાર હાઈબ્રિડ પોલીસે અંતર્ગત વિન્ડ ટર્બાઈન ઈન્સ્ટોલ કરીને તેને કમિશનિંગ કરવાનું શ્રેય જાય છે. કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ફારુક જી. પટેલના વિઝન અને સાયન્ટિફિક એપ્રોચને કારણે આ પ્રોજેક્ટ આગળ વધ્યો અને કંપનીએ હાઈબ્રિડ પ્રોજેક્ટ અંતર્ગત ભરૂચ જિલ્લાના કોરા ગામ ખાતે કુલ સાત વિન્ડ ટર્બાઈન નાંખી છે. જ્યારે સારોજ અને સામોજમાં સોલાર પ્લાન્ટ નંખાયો છે. અત્યાર સુધી પવન ચક્કી માટે શ્રેષ્ઠ હવા ગુજરાતના ભાવનગર, પોરબંદર, કચ્છ સહિતના વિભાગો મહત્વના મનાતા હતા. પરંતુ કેપી ગ્રુપના આ ખૂબ જ અભ્યાસુ સાહસથી રિન્યુએબલ એનર્જીના ક્ષેત્રને નવી દિશા મળી છે અને દક્ષિણ ગુજરાતમાં પવનચક્કી સેક્ટરમાં નવા બીજ રોપાયા છે.

કંપનીના સીએમડી ફારુક જી. પટેલે કહ્યું કે, ગુજરાત સરકારની બિઝનેસ ફ્રેન્ડલી રિન્યુએબલ એનર્જી પોલિસીને કારણે પ્રોજેક્ટ સરળતાથી પૂરો કરી શકાયો છે. ટર્બાઈનની ત્વરિત જોગવાઈ કરવા બદલ સુઝલોન અને સેવિયોન કંપનીનો પણ



આભાર વ્યક્ત કર્યો. ફારુક પટેલે નોવિયો જવેલરી એલએલપીના પ્રમોટર બકુલ લિમ્બાસિયાનો વિશેષ આભાર વ્યક્ત કરતા કહ્યું કે, તેઓએ અમારી કંપનીના વિઝનમાં પ્રથમ વિશ્વાસ કરીને રોકાણ કર્યું. તેઓએ ભરોસો મુકવા બદલ સ્ટેકહોલ્ડર્સનો પણ આભાર વ્યક્ત કર્યો. ફારુકે કહ્યું કે, પ્રધાનમંત્રી મોદીના ૫૦૦ ગીગા વોટ્સના રિન્યુએબલ એનર્જીના લક્ષ્યમાં અમે પણ યોગદાન આપી રહ્યાં છે તે અમારા માટે ગર્વની વાત છે.

આ સાત વિન્ડ ટર્બાઈનો નોવીયો જવેલરી એલએલપી, ગ્રીન લેબ ડાયમંડ, મોનો સ્ટીલ માટે સીપીપી હેઠળ અને એક ટર્બાઈન કેપીઆઈ ગ્રીન એનર્જી લિ.એ પોતે આઈપીપી હેઠળ ઈન્સ્ટોલ કરી છે. કેપી ગ્રુપ દક્ષિણ ગુજરાતમાં બીજા ઘણા પ્રોજેક્ટ્સ સ્થાપિત કરવા માટે આતુર છે, અને તે વર્ષ ૨૦૨૫ સુધીમાં બે ગીગાવોટ્સ સોલાર-વિન્ડ પ્રોજેક્ટ કરવાનો લક્ષ્ય ધરાવે છે.

ભરૂચ જિલ્લામાં કેપી ગ્રુપના વિઝનરી ચેરમેન-મેનેજિંગ ડિરેક્ટર ફારુક જી. પટેલે સાયન્ટિફિક એનાલિસીસ કરાવીને નવું સાહસ ખેડી સાત પવનચક્કી ઉભી કરી